



Oasis Aisi Ki Taisi Movement

a project undertaken by **Oasis Movement**

*Exams are not a **life-Jacket**;
but, **talent, hard work & willingness to learn** are.*

CONTENT**INDEX**

Objectives of 'Aisi Ki Taisi movement'	01
--	-----------

About the book 'Exam and Result Ki Aisi Ki Taisi'	02
---	----

What do education & results of exams of world's great people tell us?	03
--	-----------

Overview of 'Aisi Ki Taisi movement'	04
--------------------------------------	----

Photo glimpses of 'Aisi Ki Taisi Sessions'	05
--	-----------

Reflections from facilitators	07
-------------------------------	----

Memorable experiences during sessions	08
---------------------------------------	-----------

Events	10
--------	----

Media reflections	13
-------------------	-----------

Statistics of 'Aisi Ki Taisi movement'	14
--	----

Other Oasis Publications	15
--------------------------	-----------



Oasis Aisi Ki Taisi Movement



SOS MOVEMENT

Save Our Students



• *Objectives of Oasis 'Aisi Ki Taisi Movement'*

The movement began with the booklet '*Exam ki aisi ki taisi*' written by Sanjiv Shah (Founder, Oasis Movement).

What he shared about the booklet and its' purpose:

"The booklet '*Exam ki aisi ki taisi*' has been primarily written for students in general so that they don't lose heart, get frustrated or consider exams and scorecard as the finality of their life.

However, I am equally certain that many parents and even teachers would be taken aback by the title of this booklet, perhaps hold me accountable for misguiding students, and also accuse me of teaching them carelessness instead of hard work.

I have a request to all these adult friends – please go and meet the families of those students who have committed suicide dreading or due to their poor exam results. Give them this book and ask them whether given a chance, wouldn't they have chosen to give this message to their child before losing him forever?!

And then, try to imagine - what if our child or some other kids around us are experiencing a similar turmoil and loneliness today?

I have only one question and the very answer to it is the objective of this booklet:

Are results of exams more important to us than our child's life, his future and his happiness? "



Enjoy



Learn



Fight for own rights

• About the book 'Exam and Result Ki Aisi Ki Taisi'

'Exam Ki Aisi Ki Taisi'

Exams are coming soon... the test are near...

Am dead... am in a soup!

What will happen! O God... Please help!

Wish I got some more time to study!

Exams are over... now the tension of scores!

What'll be my result... what marks will I get...?

Will I pass or not... What if I fail?

Gosh! My hearts is pounding so hard!

Are these damn exams of any use to us!

Isn't there a way to escape them?

If I get bad results, wonder what I'll do?

My life will be ruined!

NO! Not at all. Attention, Breaking News!

Well friends, times have changed.

Now you are in control of your life.

You can actually tell exams to "Go to Hell"!

'Result Ki Aisi Ki Taisi'

Exams are done with... what a relief!!!

But the saga doesn't seem to end yet...

As we await our results...

O God, what will my mark-sheet look like...?

Will I pass or not... but wait, what if I fail...?

What if I score less marks in my core subject?

And what if the results are below my expectations...?

Very strange, isn't it? How come everyone is tensed about results!

But then, are results really that important?

Do you know-

Mahatma Gandhi scored 40% in his matriculation exams!

Sachin Tendulkar failed thrice in his SSC exams!

Great scientist Einstein never cleared his high school exams!

Genius mathematician, Ramanujan, failed in collage exams 3 times!

Legendary singer Lata Mangeshkar, never really went to any school!

Well, let me share a secret...shhhh...don't tell anybody!!!

Don't ever be fooled by the fear of results.

No life can be destroyed by exam results.

Want further proofs? Go ahead then, read this book...

'Fail in the exam = Fail in life has not been proven yet.'

• *What do education & results of exams of world's great people tell us?*



Lata Mangeshkar

- No formal school education, rejected as a singer initially due to her thin voice.
- Famous as the melody queen all over the world, bestowed with the coveted 'Bharat Ratna.'
- Has a successful career as a playback singer for over 70 years.

Popularly known to the world as 'The nightingale of India,' 'Melody queen,' Lataji, had started working as an actress in her father's musical plays when she was 5 years old. Within few days, she stopped going to school. Music was in her blood as she had inherited it from her father and hence at a very young age, she started practising singing. She sang her first film song at the age of 13. That year, her father passed away and she had to shoulder the responsibility of the whole family. She started acting in plays and films and in a few years moved to Mumbai.

Initially, Lataji was rejected by musicians as they thought that she had very thin voice! And with the same voice, in the next 50 years, she won the hearts of the music lovers in India. Her journey as a playback singer started when she was 16 years old and went on for 70 years. In 1949, at the age of 20, her song from the movie 'Mahal,' made her famous all over India.

In the 60s, 70s and 80s, Lataji became the most eminent Bollywood singer. She received back to back awards and her popularity increased globally.

Crux of the matter:

"To hell with exams" attitude doesn't imply that we don't need to learn. What it means, dear friends, is that right education is about learning and not cramming. The purpose of education is not to pass and succeed in examinations, but to be successful in life. All those who do not recognize their talents, don't work hard, or don't use time productively, don't learn, get jittery over tiny matters, get disheartened, and give up; all of them fail in life. If the importance of life is 100%, then exams are not even 1% important.

● *Overview of 'Aisi Ki Taisi Movement sessions*

Step 1: 1 hour sessions of 'Exam Ki Aisi Ki Taisi' are organized by volunteers for students of class 10th and 12th. The booklets are distributed among these students. Students promise that after enough hard work, whatever happens in exams they will not be dishearten and they will focus on their talents.

The aim of these sessions is to spread the message of facing the exams with courage and hard work and not to be disheartened by results. Eventually the message will be reaching to parents, relatives, teachers, and principals to keep an encouraging approach towards the children instead of creating pressure.

Step 2: The same volunteers go back to same students with session & booklet – 'Result ki aisi ki taisi'. The message is - Result of Exams has hardly anything to do with success in life, which is evident from the lives of Great People of the World, starting from Thomas Alva Edison, Mahatma Gandhiji to Sachin Tendulkar.

Step 3: Oasis Life Classes (monthly 2 hrs sessions for the same students to bring out their hidden potentials and to learn principles of life for greatness) for all students involved.



Happiness on the faces of students & facilitator at the end of the session!

• Photos glimpses of 'Aisi Ki Taisi' Movement



The result of
the exam is not
the end of the life



Enjoying the session in a relaxed manner



Book reading time



Reading the book during the session makes it a learning experience

Participants with Facilitator



Students are taking a pledge that they will never be afraid of exams and will work hard

● *Reflections from facilitators*

જેમના માર્ક્સ સારા આવતા નહોતા તે વિદ્યાર્થીઓએ છેલ્લે મને કહ્યું, “દીદી, અમે પણ કામના વ્યક્તિ છીએ અને જીવનમાં ચોક્કસ કંઈક તો કરશું જ. થેન્ક યુ, તમે આવ્યા.” તેમના આ વાક્યો ખરેખર મને સ્પર્શી ગયાં. “હું જ્યારે પણ છાપાઓમાં કે Social Media પર પરીક્ષાના કે રિઝલ્ટના ડરને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી તેવા સમાચાર વાંચતી કે સાંભળતી ત્યારે મારું દિલ રડી પડતું. એક નિઃસહાયતાની લાગણી થતી. પણ, “એકઝામ કી ઐસી કી તૈસી” પ્રોજેક્ટથી એક આશાનું કિરણ બંધાયું. હું જ્યારે સેશન લેવા ગઈ ત્યારે સૌથી પહેલાં તો મેં અનુભવ્યું કે આ બાળકો પાસેથી તેમનું બાળપણ જ છીનવાઈ ગયું છે. આનંદ-ઉત્સાહની જગ્યાએ ભારે-ભરખમ વાતાવરણ. પણ પછી જ્યારે મેં તેમની સાથે મારા ઉદાહરણો વહેંચ્યાં અને જણાવ્યું કે અહીં હું તમારી મિત્ર બનવા આવી છું, તમને સાંભળવા આવી છું; ત્યારે થોડીવારમાં બધાં બાળકોનાં મોઢાં પર હાસ્ય આવી ગયું. અને બધાં પોતાના દિલની વાત કહેવાં માંડ્યાં.

- પૂર્વી દલાલ, Volunteer, સુરત

“પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનમાં ભૂંડંપ લાવી દે છે, એમ કહું તે જરાય ખોટું નથી. બાળકે એક તો, પોતાની રસ-રુચિ સિવાયના વિષયોને સરખો ન્યાય આપવાનો, અને બીજું, માતાપિતા અને શિક્ષકોની અપેક્ષાઓને સંતોષવાની અને શાળાનું નામ રોશન કરવાનું. આ બધા વચ્ચે બાળક માર્ક્સ અને ટકાની મારામારીમાંથી ઊંચો નથી આવતો અને સૌને સંતોષ ન આપ્યાની વ્યથામાં અટવાતો રહે છે. “એકઝામ કી.....” પ્રોજેક્ટ બાળકો માટે ખૂબ લાભદાયી રહ્યો. ટેન્શનમાં આવીને ગૂંગળામણ અનુભવતાં બાળકો ડિપ્રેશનમાં જતાં હોય કે આત્મહત્યા તરફ પ્રેરાતાં હોય, તેમને મદદ કર્યાનો એક સંતોષ થયો. આવાં સેશન થતાં રહે તો કેટલાંય બાળકોને બચાવી શકાય.”

- બેલા જોષી, Volunteer, નવસારી

● Memorable experiences during sessions

ભુજની એક શાળામાં “એકઝામ કી એસી કી તૈસી” સેશન દરમિયાન હૃદયસ્પર્શી અનુભવ.

વર્ગમાં અંદાજે ૫૫ જેટલી વિદ્યાર્થીનીઓ હતી. સેશન દરમિયાન દરેક ખૂબ જ ખુશી સાથે ખીલીને પોતાની વાતો, પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી રહી હતી પરંતુ એક વિદ્યાર્થીનીના ચહેરા પર તંગ રેખાઓ અને સેશનમાં કોઈ રસ નહીં. થોડો ગુસ્સો પણ ખરો. ચહેરા પરથી ખ્યાલ આવતો હતો કે કંઈક તો તકલીફ છે, પણ બોલવા તૈયાર નહોતી. જ્યારે બધાને પૂછવામાં આવ્યું કે કોઈ અંગત પ્રશ્ન હોય તો કહો, થોડી વિદ્યાર્થીનીઓએ કહેવાનું શરૂ કર્યું પણ એ દીકરી બોલવાનું નામ જ ના લે. પછી તો વર્ગની બધી દીકરીઓ કહેવા લાગી બેન આને ખૂબ જ મોટો પ્રશ્ન છે એને પૂછો, પણ એ દીકરી કશું જ ના બોલી ફક્ત ગુસ્સાથી જોયા જ કરે. મેં મારી નજરમાં એના માટે ખૂબ જ પ્રેમ અને સહાનુભૂતિ સાથે નજર મેળવાની કોશિશ કરી પણ કોઈ પ્રત્યુત્તર નહીં મળ્યો એટલે સેશન પૂર્ણ થતા મેં છેલ્લીવાર એની સાથે પ્રેમ ભરી નજર મેળવી અને ફરી આવવાના વચન સાથે બહાર નીકળી.

હું બીજા ફેકલ્ટી સાથે વાત કરતી હતી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એ વિદ્યાર્થીની રડમસ ચહેરા આવીને મને વળગી પડી. ડુસકા ભરી રડતી હતી એટલે હું પણ ગભરાઈ ગઈ પણ પ્રેમથી ગળે લગાવી તેને સમજવાની કોશિશ કરી રહી હતી. ત્યારે દીકરીએ બોલવાની શરૂઆત કરી અને મારી આંખો અંધારા આવી ગયા.

દીકરીના શબ્દો- “બેન મને મારા જીવનમાં હવે કોઈ રસ નથી, મારા કુટુંબમાં મને કોઈ પણ સમજતું જ નથી. મને સતત ટોક ટોક કરવામાં આવે છે, મને એકલું એકલું લાગે છે, મને ભણવામાં હવે કોઈ રસ નથી, આ દુનિયામાં મારું કોઈ જ નથી એવું લાગે છે અને મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે જે મારા ઘરવાળાને ખબર પડી ગઈ છે એટલે મારા પર ખૂબ જ પાબંદી છે અને હું ઘરમાં ગુંગળામણ અનુભવું છું એટલે હવે હું આત્મહત્યા કરી લઈશ અને મારી આત્મહત્યાની નોંધ પણ તારીખ ૧૪થી લખી રાખી છે હવે હું ગમે ત્યારે આ દુનિયા છોડી દઈશ.”

મેં સ્વસ્થતા કેળવી ખૂબ જ વહાલ સાથે થોડી વાર તેની સાથે વાતો કરી, થોડા પ્રશ્નો કર્યા, એને સાંભળી, સમજી, મારી પોતાની જિંદગીની વાતો કરી. મારા આશ્ચર્ય વચ્ચે દીકરીની આંખોમાં ચમક આવી, મને લાગ્યું એનામાં કોઈક હકારાત્મક ફેરફાર થયો અને જુસ્સો દેખાયો. થોડી જરૂરી અને સારી વાતોની આપ લે થઈ, પછી એ દીકરીએ મને ખોટું પગલું નહીં લે એના માટે વચન આપ્યું. મેં એને જલ્દી ફરી મળવાનું વચન આપ્યું, એના ચહેરામાં ચમક જોઈ ફરીથી ગળે લગાવી અને પછી હસતા મોઢે વર્ગ ખંડમાં ગઈ. હું એને જોતી રહી. એક સારું કામ થયું એનો ખૂબ જ સંતોષ થયો. શાળામાં રજા હોવાથી મુલાકાત ના થઈ પણ તરત બે દિવસ પછી ફરીથી ફોલોઅપના બહાને શાળામાં ગઈ અને એ દીકરીને મળી. એની સાથે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે એણે ઘરમાં પોતાનું વર્તન બદલી નાખ્યું. પોતાની જવાબદારી અને ફરજ સમજી. ઘરના તંગ વાતાવરણમાં પણ માતા પિતા સાથે પ્રેમથી વાતો કરી અને હવે એ ખુશ છે તથા એ દીકરીની મા પણ હવે મળવા માંગે છે. એક જીવ બચી ગયો.... હું હૃદયથી ખૂબ જ સારી લાગણી અનુભવી રહી છું.

જિંદગીમાં કોઈકની સાચી મદદગાર બની શકવા માટે કુદરતનો ખૂબ ખૂબ આભાર ...

મારી આંખમાં હર્ષના આંસુ છે ... અને ચહેરા પર ખુશી ...

- કરુણાબેન ત્રિવેદી, ગૃહિણી, ભુજ

“એકઝામ કી ઐસી કી તૈસી” કરવાનો સેશન એટલે બાળકોને ભણતરના ભારથી હળવા કરવાનો સેશન. જ્યારે પુસ્તકનું ટાઇટલ વાંચ્યું ત્યારે થયું કે સંજીવભાઈએ આવું નામ કેમ રાખ્યું હશે? પરંતુ જ્યારે આખું મોડ્યુલ જાણ્યું, પુસ્તક જાતે વાંચ્યું ત્યારે જાણ થઈ કે જીવનમાં પુરુષાર્થ, સફળતાની ચાવી વગેરે પણ બાળકને મળવાની જ છે એ જાણી આનંદ થયો. આ સેશનમાં મેં જે મેળવ્યું છે તે અત્યાર સુધીની મારી શિક્ષણની કારકિર્દીમાં ક્યારેય નથી મેળવ્યું.

બાળકોએ ક્યારેય ધાર્યું જ નથી હોતું કે તેમને ક્યારેય આવી મોકળાશ મળશે અને તેથી મારા વર્ગમાં પ્રવેશતાની સાથે જ એક બાળકે સીટી મારી. હું તેની પાસે ગઈ અને તેની છુપાઈને નહીં પરંતુ સામે કરી બતાવેલ હિંમત માટે આખા વર્ગમાં વધાવી લીધો. તેને એવી આશા પણ ન હતી કે આવી બાબત પર તેમણે વધાવવામાં આવશે. અને ત્યારબાદ તે જ બાળક આખા સેશનમાં ખૂબ જ લાગણી સાથે વ્યવહાર કરવા લાગ્યો અને છેવટે પુસ્તક વહેંચવામાં પણ મદદ કરી. ઉપરાંત દરેક બાળક શિક્ષા પ્રત્યે પોતપોતાની પીડાને કહી રહ્યો હતો. ત્યારે તેમાંનો એક બાળક શરૂઆતથી જ ખૂબ શાંત અને ગભરું હતો કે જેને પણ પોતાની પીડા વ્યક્ત કરવાનું મન થયું. અને માટે તે ઊભો થયો પરંતુ થયું એવું કે એ બાળક દેખાવે એટલો સારો ન હતો તેથી આખો વર્ગ તેને ચીડવે અને આ સમયે પણ બધા તેને ચીડવા માંડ્યા અને એ બાળક રડતો રડતો બેસી ગયો ત્યારે મેં આખા વર્ગને સમજવું ત્યારે સૌએ મળીને તેને માનથી બોલાવ્યો અને તેણે પોતાનો મુદ્દો કહ્યો. આ પ્રસંગ ખરેખર મારા માટે ખૂબ જ યાદગાર બની ગયો કે જે મને શીખવી ગયો કે બાળકો પ્રેમ અને આદરના ભૂખ્યાં છે. અને જો તેમને આદર અને પ્રેમ આપવામાં આવે તો તેઓ આપો આપ ખીલી ઊઠે છે. મારા જીવનના આ સુખદ પ્રસંગો ઓએસિસના આંદોલન થકી જ સર્જાયા છે.

Thank you so...much OASIS....

- પરિશાબેન, આચાર્યા, અમદાવાદ

“એક વિદ્યાર્થીએ ‘એકઝામ કી ઐસી કી તૈસી’ પુસ્તિકા એના પિતાને વાંચવા આપી. પિતા ટાઇટલ વાંચીને જ પ્રથમ તો ભડકી ઉઠ્યા. ગુસ્સામાં બોલ્યા કે કયો સાહેબ આવું ઊંધુચત્તું શીખવી ગયો? લાવ એનો નંબર! વિદ્યાર્થીએ શાંતિથી અને નીડરતાથી કહ્યું કે પપ્પા પહેલા ચોપડી તો વાંચો. સરસ લખ્યું છે. પિતા જેમ જેમ વાંચતાં ગયા તેમ તેમ તેમના ચહેરાની તંગ રેખાઓ હળવી થતી ગઈ...અંતે બોલ્યા: ‘તું મહેનત કરજે પણ પરીક્ષાનો ડર ન રાખતો...!’”

- સુનિલ શાહ, volunteer, સુરત

“Exam ki aisi ki taisi is best session now days because students are very pressurized due to exams. When I went to take this session I kept my whole effort to understand the students out there.

One of my best experiences was when I took the session and one girl stood up and told me "I have big fear of exams. Also my parents force me to go in diploma but I am not interested in it. After this day I promise you that I will choose the field which I like and now I will try to be positive. Thank you so much to come in our class.... It is very important decision of my life and now I am confident enough to challenge anything!"

- Krishna Kachhela, Volunteer, Navsari

• Events

- **Press conferences**
- **Swabhimaan Vijay Rally**



Press conference



Slogans:

Are Children for Schools Or Schools for Children?

Are we Slaves or Students in School?

ભલે અમે છીએ નાના, અમને નાદાન ના સમજો!

દેશ સ્વાધીન પણ બાળકો હજુ પારાધીન

ભલે માર્ક્સ આવે થોડા, અમને બુદ્ધ ના સમજો!

મોટા લોકોને સ્વતંત્રતા તો બાળકોને કેમ નહીં?

I may be poor in studies, but not in Talents!

જ્યાં માર્ક્સીટના ગુણની અપેક્ષા, અને ચારિત્ર્યના ગુણની ઉપેક્ષા... તો કેવો બનશે સમાજ!

શાળાને દુઃખી બાળકોની ફેક્ટરી નહીં, ખુશાલ વિશ્વ- નાગરિકોની નર્સરી બનાવો...

જેલમાં બધું જ ફરજિયાત છે, શાળામાં બધું જ ફરજિયાત છે. બંનેમાં શું ફર્ક છે?

જેલમાં દંડો પડે અને શાળામાં સોટી પડે. બંનેમાં શું ફર્ક છે?



Students' Swabhimaan rallies at various cities & towns



Children asking for their rights and are determined to fight for them



Mass awareness events:

In year 2017, Just before the start of Boards Exams in Gujarat (10th & 12th Std.), Oasis organized awareness program to appeal the parents & family members of students not to create unnecessary pressure of these exams on their children.

The program was organized in 3 cities of Gujarat - Surat, Ahmedabad & Vadodara. Leading citizens including Doctors, Social Activists, Architects, and School Principals took part in this program and appealed to all through Press & Media.



The successful people from the society sharing personal experiences of doing 'Result ki -aisi ki taisi' in their life



Media reflections of Events

હાલના શિક્ષણથી સંસ્કાર નથી મળતા માત્ર ડિગ્રીઓ મળે છે

આ પછી આધુનિકતા તરફની દોડ અને કોર્પોરેટ સ્ટ્રક્ચરના સમયમાં શિક્ષણ પણ એટલું બધું અપરં બનતું જાય છે કે બાળકોને પોતાના અભ્યાસની ચિંતા એટલી બધી વધી ગઈ છે કે પોતાની સ્વતંત્રતા, આનંદ અને સન્માન છીનવાઈ ગયા છે. બાળક પોતાના જીવનમાં કેટલું સફળ થાય છે એના કરતા તે કેટલું સાર્યક કામ કરે છે એ મહત્વનું છે. આજકાલ થો ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર થયા છે ત્યારે દરેક સંસ્થાઓ અને મિડિયા બધા જ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરે છે પરંતુ નાપાસ વિદ્યાર્થીઓનું શું? શહેરમાં કામ કરતી એક સંસ્થા દ્વારા સદવિચાર પરિવાર કેમ્પસના મદનમોહન હોલ ખાતે વિદ્યાર્થી



આજનું શિક્ષણ નિષ્ફળને તક નથી આપતું
જે શિક્ષણ સંસ્કાર આપી શકે તે સ્વાભિમાન, આનંદ અને સન્માન અપાવી શકે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં પણ નિષ્ફળને તક મળે તેવી વ્યવસ્થા નથી. પરંતુ આપણી પારંપરિક ગુરુકુળ વ્યવસ્થામાં અનેક તકો મળે અને દર જેટલી કળાઓ શિખી શકાય તેવી વ્યવસ્થા હતી. **ગોપાલ સુતરિયા**
પોતાના અંતરઆત્માને પુછી આગળ વધો

પરીક્ષાનું પરિણામ એ કોઈ જીવનના અવસરનો અંત નથી

ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ ન મેળવનાર બાળકો માં ઓએસિસ દ્વારા વિદ્યાર્થી સ્વાભિમાન રેલી અને યુવા પ્રતિભા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો હેતુ : વિદ્યાર્થીઓને એ સંદેશ આપવાનો છે કે પરીક્ષાનું પરિણામ એ કોઈ જીવનના અવસરનો અંત નથી. જીવનની સાચી સફળતા કલ્પ સારા માકસે કે ટકાવવાથી નહિ પરંતુ માનવ્ય પદાર્થો સાથે છે. પરીક્ષામાં આવેલ માત્રનું આપણી મર્યાદાઓમાત્ર નથી. આપણી અંદર રહેલ પ્રતિભાઓ, આપણા ચારિત્ર્યના ગુણો, આપણા સ્વભાવનો ભાવે તે માટેની ભરપૂર પુરુષાર્થ એ જ આપણી ખરી આપણી સતત શીખવા ઈચ્છુક હોઈ શું તો અગણિત અવસરો મળવાના જ છે.

સામાજિક આપણી સમગ્ર કક્ષામાં આપણને છે જેઓએ પરીક્ષામાં સારો દેખાવ કર્યો ન હોય છતાં આજે સફળ છે. કેમકે પરીક્ષા તરફના તેમજ સમાજ જેને નિષ્ફળતા ગણે છે તેવા

નાપાસ થયો હતો આજે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક કે કામ કરું છું. હાલ શિક્ષણ વ્યવસ્થાથી હું નાખુશ છું મોં નહિ પરંતુ મારી ઘરે રહી ભણે છે. **દિનેશ મજાહિયા**

નવગુજરાત સમય | અમદાવાદ | ૧

અરાઉન્ડ ધ સિટી

બોર્ડમાં ધાર્યું પરિણામ ન મેળવનાર છાત્રોનું સન્માન

અમદાવાદ : ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના પરિણામ આવી ગયા છે ત્યારે ધાર્યું પરિણામ ન મેળવનારના વિદ્યાર્થીઓ માટે ઓએસિસ દ્વારા વિદ્યાર્થી સ્વાભિમાન રેલી અને યુવા પ્રતિભા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨ જૂન સોમવારના રોજ સવારે ૯ વાગ્યે સદવિચાર પરિવાર કેમ્પસ મદનમોહન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની શરૂઆત યુવા પ્રતિભા સન્માન સમારોહથી થશે અને ત્યાર બાદ કાર્યક્રમના સ્થળેથી વિદ્યાર્થી સ્વાભિમાન રેલી યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નાપાસ

city ANCHOR

ફાઇટ બેક કરો નિષ્ફળતા નિવારો : આજે વિદ્યાર્થી સ્વાભિમાન રેલી

૧૦ અને ૧૨માં પોરણના રિઝલ્ટ ડિસ્કવર થઈ ગયા છે. જેમાં ઘણા સ્ટુડન્ટ્સને ધાર્યું પરિણામ મળ્યું અને ઘણાને ન મળ્યું. ધણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ પ્રતિભાઓ પોતાની વાત દ્વારા આ વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આપશે.

ફાઇટ બેક
શહેરની ઓએસિસ સંસ્થા દ્વારા પરીક્ષામાં નિષ્ફળ થયેલા સ્ટુડન્ટ્સ માટે સ્વાભિમાન રેલીનું આયોજન કરાયું

હું ૩ વખત નિષ્ફળ થયા છતાં ડરોં નહીં, ઝાઝૂમીને સફળતા મેળવી
હું અભ્યાસમાં નિષ્ફળ થયો નથી. મિત્રોનાં મને પણ નિષ્ફળતા મળી છે. મેં પહેલા મેન્-અફ-મિનિયનમાં જીતવાનું હતું પરંતુ મને નિષ્ફળતા મળી હતી. ત્યારે મારી પાસ થયેલ મને મેન ઓફ યીર હતી. આજે એ સમય મને સાચા મિનિયનને તરફે આવી શકે છે. નિષ્ફળતાથી ધરતું જોઈએ નહીં. શ્રીજા પ્રયત્નો કરી આગળ વધી સફળ થવું જોઈએ. નિષ્ફળતાને પચાવવા માટે સહાય તમાર રહેવું જોઈએ. **મરત ધેલ**

ખોટું પ્રગલ્ભ ભરવાનો વિચાર કરતાં પહેલાં પરિવારને ચોક્કસ યાદ કરો
મને પહેલી નિષ્ફળતા ૭મા ક્લાસમાં મળી હતી. ત્યારે પપાનાં દરમી હું પર છેડી ભાઈ ગયો હતો. પરંતુ મમી સાથે હોન પર રાત કરી એક કિસ્સો પછી વરે પાણી વધ્યો હતો. મીમીએની એકાગ્રતામાં બીજા મહત્ત્વ કરી પરંતુ તેમાં મારી લેવાની વાત કરી હતી. મીમી મોટી નિષ્ફળતા મળી. પરંતુ હવે મને વર આગળ વધવાનું નહિ કરીને ઓએસિસમાં અભ્યાસ અને જોય કરી અને આજે પોતાની શોરમા મિત્રોને કહું છું. **ધવલ પટેલ**

એકાગ્રતામાં સ્ટુડન્ટ નહીં બુકનું નોલેજ ફેલ થાય છે
હું ૧૨ ક્લાસમાં મેં તમામ ફેલ થઈ હતી. ત્યારબાદ એકાગ્રતામાં આવી એકાગ્રતામાં પુરું કરું હતું. એકાગ્રતામાં માત્ર પછી નામાંકિત બેક જોડે કામ કરું હતું. હાલમાં શહેરમાં મારી હોમ લોન એજન્સી છે. સ્ટુડન્ટ્સને જણાવવા માનુ છું કે, એકાગ્રતામાં બુકનું નોલેજ ફેલ થાય છે. બુકનું ક્યારે ફેલ થતો નથી. **વરમ શાહ**

નિષ્ફળતાથી કરો નહીં | નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માટે અનોખો કાર્યક્રમ યોજાશે

અમે પણ નાપાસ થયેલાં: સેલિબ્રિટી સાથે સ્ટુડન્ટ્સ સ્વાભિમાન રેલી કાઢશે

સમા અને ભારમાં પોરણના રિઝલ્ટ ડિસ્કવર થઈ ગયા-જેમાં ઘણા વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળ્યું અને ઘણાને ન મળ્યું. ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ વિદ્યાર્થીઓ માટે શહેરની ઓએસિસ સંસ્થા દ્વારા એક અનોખી રેલીનું આયોજન કરાયું છે. આ રેલી ૧૦ જૂન, જીવનભારતી સ્કુલથી નીકળશે. જેમાં શહેરની એવી પ્રતિભાઓ જોડાશે, જે નાપાસ થયાં હતા. આ પ્રતિભાઓ પોતાની વાત દ્વારા આ વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આપશે.

રેલી પછી સ્ટુડન્ટ્સ સાથે શહેરની આ સેલિબ્રિટી પોતાની નિષ્ફળતાઓ વિશે વાત કરશે

નાપાસ થયો, ડ્રોપ લીધો, આજે સાઈકિસ્ટ્રીટ છું
MADHUSU હું એ વખત કેટલું થયો અને એ વખત ડ્રોપ પણ લેવો પડ્યો. સાઈકિસ્ટ્રીટનું નામ મને નિષ્ફળ થયેલ વર્ષમાં કોલેજમાં ગયા વિના જ મળી ગયેલું. આ સમયમાં મેં જાડમીની શેફ ગઝલો લખી છે. મારે તો ગુજરાતીમાં પ્રોફેસર બનવું હતું. મુજ પેપરમાં ટેન્ડેની તરીકે પણ જોડાયેલો. એ વખતે રિજીનોની આપક મોટી એલેક્સ મિત્રોની એક વખતે MADHUSU હું

સાયન્સનાં બધાં વિષયોમાં નાપાસ થયેલો, આજે આઈકિટ ડિપાર્ટમેન્ટમાં હેડ છું
હું હાલમાં માઈન્ડમાં ધાસ થયો. મેં સાયન્સમાં એડમિશન લીધું પણ પછીથી ડ્રોપમાં મળ્યા જ વિષયમાં કેટલું થયો. બીજા ક્લાસમાં રિજીન અને અન્ય વિષયોમાં કેટલું થયો. બીજા વારે ધાસ થયો. પછી મેં આઈસમાં એડમિશન લઈ લીધું. આઈસ ટીચર ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ગુજરાતી ૧૬ કોલેજમાં પસંદગી મળ્યો, આજે આઈકિટ ડિપાર્ટમેન્ટમાં હેડ છું.

નાર સાયન્સનાં ગણિતમાં ફેલ થયો, આજે મારું બેઝ યુથનું ફેરિટ છે..!
હું હાલમાં માઈન્ડમાં ધાસ થયો. મેં સાયન્સમાં એડમિશન લીધું પણ પછીથી ડ્રોપમાં મળ્યા જ વિષયમાં કેટલું થયો. બીજા ક્લાસમાં રિજીન અને અન્ય વિષયોમાં કેટલું થયો. બીજા વારે ધાસ થયો. પછી મેં આઈસમાં એડમિશન લઈ લીધું. આઈસ ટીચર ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ગુજરાતી ૧૬ કોલેજમાં પસંદગી મળ્યો, આજે આઈકિટ ડિપાર્ટમેન્ટમાં હેડ છું.

કેમેરી, ક્રિકેટ, ગણિતમાં ફેલ થયેલો!
હું ૧૨ ક્લાસમાં કેમેરી, ક્રિકેટ અને ગણિતમાં ફેલ થયો હતો. કેટલું થયો પછી તરત જ મેં નોટીસ શોરમાની શરૂઆત કરી દીધી. પછી મેં આઈસમાં એડમિશન લઈ લીધું. આઈસ ટીચર ઈન ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ગુજરાતી ૧૬ કોલેજમાં પસંદગી મળ્યો, આજે આઈકિટ ડિપાર્ટમેન્ટમાં હેડ છું.

નાપાસ થયું પણ ક્યારેક જરૂરી હોય છે-જેમકે હાલમાં સુધી ડાઉનથી પસંદગી મળી છે.

રેણામ એ કોઈ જીવન અંત નથી : ઓએસિસ

૨૭ વર્ષની તો અગણિત અવસરો મળ્યા. જે મેં જાનું સંખ્યાઓ પરીણામ નહિ. મેમ્બરનાર વિદ્યાર્થીઓ માટેના આ કાર્યક્રમ તા.૧૦ જુનના રોજ રેણામના હોલ, જીવનભારતી આણંદ નથી સ્કુલ નાનપુરમાં અપરે ૩.૩૦ થી સાંજે ૫.૩૦ કલાક ફરમાન રાખવામાં આવ્યો જ આપણી છે. જેમાં જોડાયા માટે ઓએસિસ દ્વારા રમ્યા અગર શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે.

• *Statistics*

• *We touched:*

450+ schools

2,782 sessions & classes

50,000+ beneficiaries

500+ volunteers

& thousands through

Rallies, Press conferences, Talks

Regions/ Cities	EKAKT Sessions	RKAKT Sessions	Life Classes
<i>Ahmadabad & N. Guj.</i>	166	85	1300
<i>Bangalore</i>	40	-	-
<i>Kutch-Bhuj</i>	289	82	15
<i>Navsari</i>	158	53	3
<i>Rajkot</i>	11	-	-
<i>Surat</i>	192	37	63
<i>Vadodara</i>	144	13	11
<i>Dangs</i>	31	-	-
<i>Anand</i>	35	-	-
Total	1093	297	1392



● Other Oasis Publications

ઓએસિસનાં પ્રકાશનો

પુસ્તકો

- મહાન હૃદયોના સારંગમપદ્મિ (સંજીવ શાહ, ₹ ૫૦૦) • નૂતન વિશ્વના પ્રભાતનો કલરવ (સંજીવ શાહ, ₹ ૨૦૦) • અઘરો છે આ પ્રેમ ને અઘરા છે આશીર્વાદ! (સંજીવ શાહ, ₹ ૧૩૦) • જવાબ માગે છે જિંદગી! (સંજીવ શાહ, ₹ ૧૬૪) • જીવવું એટલે યાદવું એટલે શીખવું! (સંજીવ શાહ, ₹ ૩૦૦) • સમરહિલ (એ. એસ. નીલ, ₹ ૩૫૦) • સ્નેહ, સારવાર અને ચમત્કાર (ડો.બર્ની.એસ.સીંગલ, ₹ ૪૦૦) • આખરે... આઝાદ! (ડેનિયલ ગ્રીનબર્ગ, ₹ ૨૦૦) • હૃદયે કાંતિ (સંજીવ શાહ, ₹ ૩૫૦) • અધ્યાત્મની શોધમાં (સંજીવ શાહ, ₹ ૪૫૦) • સ્વતંત્રતા- નહીં કે સ્વેચ્છાચાર! (એ. એસ. નીલ, ₹ ૨૦૦) • અલ્પ છે જીવન, કે ગાફેલ માણસ છે? (સંજીવ શાહ, ₹ ૧૬૦) • સદીઓનું શાણપણ (લિયો તોલ્સ્ટોય, અનુ. સંજીવ શાહ, ₹ ૬૦૦) • જીવનની ભેટ (સં. સંજીવ શાહ, ₹ ૪૦૦)

ચિંતનપોથીઓ

- મહાન હૃદયોનો મૌન ધુધવાટ (સંજીવ શાહ, ₹ ૬૦) • પ્રભાતનો કલરવ (સંજીવ શાહ, ₹ ૭૦) • મહાન હૃદયોની શ્રવણકલા (સંજીવ શાહ, ₹ ૧૫૦) • જીવનમાં પૂરી હિંમતથી ગીત તમારું ગાજો! (સંજીવ શાહ, ₹ ૧૨૦) • જિંદગી (સંજીવ શાહ, ₹ ૧૫૦) • પ્રેમ (સંજીવ શાહ, ₹ ૧૨૦) • હાકલ (સં. સંજીવ શાહ, ₹ ૧૨૦) • પ્રેમાળ બનવાની કળા (એરિક કોમ, ₹ ૧૬૦) • શિક્ષકનો સેવાધર્મ (જે. કૃષ્ણમૂર્તિ, ₹ ૭૦) • લાગણીઓના ઝંઝાવાતમાં મહેકી... (સંજીવ શાહ, ₹ ૫૦) • ભાવનાઓ કે તૂફાન મેં મી મહક... (સંજીવ શાહ, ₹ ૫૦) • What Then Must We Do? (Leo Tolstoy, ₹ 70) • જ્યારે હું મને ખૂબ ગમવા લાગ્યો! (સંજીવ શાહ, ₹ ૨૦) • જ્યારે સંબંધો મને ખૂબ ગમવા લાગ્યા! (સંજીવ શાહ, ₹ ૨૦) • ...એનું નામ શક્તિ! (સંજીવ શાહ અને ઓએસિસના તરુણો, ₹ ૨૫) • પરીક્ષા શિક્ષણની! (સંજીવ શાહ, ₹ ૨૫) • શીખતાં શીખવતા (સંજીવ શાહ, ₹ ૬૪) • સદીઓનું શાણપણ (સંજીવ શાહ, ₹ ૧૫૦)

ભેટ શ્રેણી

- જીવનની ભેટ - ૧ / ૨ / ૩ (સંજીવ શાહ, ₹ ૬૧) • હું છું પોલિયાના! (પુનઃકથન: શમા કટારિયા, ₹ ૩૦) • પ્રેમની ભેટ (સંજીવ શાહ, ₹ ૩૬) • સદ્ગુણોની ભેટ (સંજીવ શાહ, ₹ ૩૦) • કાર્યક્ષમતાની ભેટ (સંજીવ શાહ, ₹ ૩૨) • સમૃદ્ધિની ભેટ (સંજીવ શાહ, ₹ ૧૨) • સફળતાની ભેટ (સંજીવ શાહ, ₹ ૧૦) • સ્વાવલંબનની ભેટ (સંજીવ શાહ, ₹ ૧૬) • સ્વવિકાસની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૦) • નારી-જીવનની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૧) • લગ્નસંબંધની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૦) • સંતાન-ઉછેરની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૫) • ચારિત્ર્યની ભેટ (અનુ. સંજીવ શાહ, ₹ ૪૦) • પસંદગીની ભેટ (સંજીવ શાહ, ₹ ૧૦) • કેળવણીની ભેટ (સંજીવ શાહ, ₹ ૩૦) • પ્રૌઢાવસ્થાની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૫) • સમર્પણની સાધના (સંજીવ શાહ, ₹ ૫૦) • એકઝામ કી એસી કી તેસી! (સંજીવ શાહ, ₹ ૨૦) • રિજલ્ટ કી એસી કી તેસી! (સં. મેહુલ પંચાલ, ₹ ૨૦) • એક પિતાનો માફી-પત્ર (સંજીવ શાહ, ₹ ૨૫) • લિખિતંગ તમારા બગડેલા વિદ્યાર્થીઓ (સિકેટ સુપરસ્ટાર્સ, સં. સંજીવ શાહ, ₹ ૧૫૦) • The Gift of Life (Sanjiv Shah, ₹ 25) • The Gift of Family (Sanjiv Shah, ₹ 30) • The Gift of Prosperity (Sanjiv Shah, ₹ 15) • The Gift of Success (Sanjiv Shah, ₹ 12) • The Gift of Leadership (Sanjiv Shah, ₹ 45)

મહાન ચરિત્ર શૃંખલા

- The Gift of Peace Pilgrim (₹ 15) • વારિસ- રણમાં ખીલેલું પુષ્પ (અનુ. શમા કટારિયા, ₹ ૨૧)

અખંડ સ્વાસ્થ્ય શૃંખલા

- આયુર્વેદની ભેટ (સંજીવ શાહ, ₹ ૧૪૦) • આરોગ્યની ભેટ (સંજીવ શાહ, ₹ ૨૫) • દાદીમા M.B.B.S.! (સં.ડો.પલ્લવી રાઉલજી, ₹ ૨૦)

જિરસાપોથી : સંવેદનાશિક્ષણ અને વિચારશિક્ષણ શ્રેણી

- વેદના / ગુસ્સો / ડિપ્રેશન / અપરાધભાવ એટલે... (સંજીવ શાહ, ₹ ૩૨) • સુખ / દુઃખ / ઈર્ષ્યા / લોભ એટલે... (સંજીવ શાહ, ₹ ૨૪) • વિચારવું / સિદ્ધાન્તો / સમસ્યા / શીખવું એટલે... (સંજીવ શાહ, ₹ ૪૦) • ધ્યેય / આત્મવિશ્વાસ એટલે... (સંજીવ શાહ, ₹ ૨૦) • ચારિત્ર્ય / પરિપક્વતા એટલે... (સંજીવ શાહ, ₹ ૧૨)

જિરસાપોથી : મહાન સિદ્ધાન્ત શૃંખલા

- જીવન મુશ્કેલ છે (સંજીવ શાહ, ₹ ૮) • મારું જીવન મારી જ જવાબદારી છે (સંજીવ શાહ, ₹ ૮) • જે દુભવે છે, તે શીખવે છે (સંજીવ શાહ, ₹ ૮) • પ્રેમ એ લાગણી નથી, કર્મ છે (સંજીવ શાહ, ₹ ૮) • મારી દૃષ્ટિ જ મારું ચારિત્ર્ય (સંજીવ શાહ, ₹ ૮) • સાચી સફળતા, સાચું જીવવામાં (સંજીવ શાહ, ₹ ૮) • વાવીએ તેવું લણીએ (સંજીવ શાહ, ₹ ૮) • મારી ભાષા જ મારું શીલ (સંજીવ શાહ, ₹ ૮)

કણિકાઓ

- જીવન-કાવ્યોની ભેટ (સં.ડો.માયા સોની, ₹ ૩૦) • હૃદયવલોભુ: સ્વ-ધડતર / સંબંધ-ધડતર (સંજીવ શાહ, ₹ ૨૪) • An Oasis of Thoughts - Love / Life / Friendship / Character (₹ 48)

નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ

એક્ઝામ કી એસી કી તેસી!



સંજીવ શાહ

નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ

રિઝલ્ટ કી ઐસી કી તેસી!



સંકલન: મેહુલ પંચાલ

*“If the purpose of learning is
to score well on a test,
then we have **lost** sight of
real reason for learning.”*

- Jeannie Fulbright



Oasis Movement

2nd Floor, Shalin Apartment, 52, Haribhakti Colony,
Race Course, Vadodara-390007, Gujarat, India

Teleflex: +91-265-2321728
Email: info@oasismovement.in